



Market News

આ દરમિયાન સપ્ટેમ્બરમાં ઔદ્યોગિક પ્રોડક્શન (IIP)ની ગ્રોથ 3.1 ટકા રહી છે. ગયા વર્ષે આ મહિને IIPનો ગ્રોથ -0.8 ટકા હતી. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન (MoSPI)એ શુક્રવારે તેના આંકડા જાહેર કર્યા છે. સપ્ટેમ્બરમાં આઈઆઈપીની ગ્રોથ 3.1 ટકા હતી.

મહિના દર મહિનાના આધાર પર સપ્ટેમ્બરમાં માઇનિંગ સેક્ટર ગ્રોથ -3.9 ટકાથી વધીને 4.6 ટકા પર રહ્યો છે. મહિના દર મહિનાના આધાર પર સપ્ટેમ્બરમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર ગ્રોથ -0.7 ટકાથી વધીને 1.8 ટકા પર રહ્યો છે.

મહિના દર મહિનાના આધાર પર સપ્ટેમ્બરમાં વીજળી ગ્રોથ 1.4 ટકાથી વધીને 11.6 ટકા પર રહ્યો છે. મહિના દર મહિનાના આધાર પર સપ્ટેમ્બરમાં પ્રાઈમરી ગુડ્ઝ ગ્રોથ 1.7 ટકાથી વધીને 9.3 ટકા પર રહ્યો છે.

મહિના દર મહિનાના આધાર પર સપ્ટેમ્બરમાં કેપિટલ ગુડ્ઝ ગ્રોથ 5 ટકાથી વધીને 10.3 ટકા પર રહ્યો છે. મહિના દર મહિનાના આધાર પર સપ્ટેમ્બરમાં ઈન્ફ્રા ગુડ્ઝનો ગ્રોથ 1.7 ટકાથી વધીને 7.4 ટકા પર રહ્યો છે.

મહિના દર મહિનાના આધાર પર સપ્ટેમ્બરમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ -2.5 ટકાથી ઘટીને -4.5 ટકા પર રહ્યો છે. મહિના દર મહિનાના આધાર પર સપ્ટેમ્બરમાં નોન-કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ -9.9 ટકાથી વધીને -7.1 ટકા પર રહ્યો છે.

વીકલી એક્સપાયરીથી પહેલા બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળી. ઇન્ડ્રા-ડે માં નિફ્ટી બેન્કે રિકોર્ડ્સ સ્તર પર પહોંચ્યા છે. નિફ્ટી બેન્કના રિકોર્ડ ક્લોઝિંગ હાઈ છે. આજના

કારોબારમાં ફાર્મા, રિયલ્ટી, PSE શેરો પર દબાણ જોવા મળી રહી છે. મેટલ, IT, ઓટો શેરોમાં ઘટાડો રહ્યો. મિડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલી રહી. ડોલરના અનુસાર રૂપિયા આજે 49 પૈસા મજબૂત થઈને 81.43 ના સ્તર પર બંધ થયો છે.કારોબારના અંતમાં સેન્સેક્સ 151.60 અંક એટલે કે 0.25 ટકાના ઘટાડા સાથે 61033.55 ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી 45.80 અંક એટલે કે 0.25 ટકાની ઘટાડા સાથે 18157.00ના સ્તર પર બંધ થયો છે.

Adani Power Q2: નાણાકીય વર્ષ 2023 ના બીજા ક્વાર્ટરમાં અદાણી પાવરનો નફો 201.6 ટકા વધીને 695.5 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2022 ના બીજા ક્વાર્ટરમાં અદાણી પાવરનો નફો 230.6 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2023 ના બીજા ક્વાર્ટરમાં અદાણી પાવરની આવક 51.5 ટકા વધીને 7044 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2022 ના બીજા ક્વાર્ટરમાં અદાણી પાવરની આવક 5184 કરોડ રૂપિયા રહી હતી.વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં અદાણી પાવરના એબિટડા 1163 કરોડ રૂપિયાથી ઘટીને 948 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં અદાણી પાવરના એબિટડા માર્જિન 22.4 ટકાથી ઘટીને 13.4 ટકા રહ્યા છે.

Graphite India Q2: નાણાકીય વર્ષ 2023 ના બીજા ક્વાર્ટરમાં ગ્રેફાઈટ ઈન્ડિયાનો નફો 28.1 ટકા ઘટીને 92 કરોડ રૂપિયા થઈ ગયો છે.

Results & Corporate Action

Result Calendar	
Date	Company Name
14 November 2022	GRASIM, BHARTFORGE, IRCTC, BIOCON, ABBOTINDIA, AARTIIND, BALKRISIND, NMDC, IBULHSGFIN, APPOLTYRE, GMRINFRA, ONGC

				
Corporate Action	Company Name	Type & Percentage	Record Date	Ex-Date
BONUS	GPT Infra	Bonus Ratio 5:1	12-11-2022	11-11-2022
BONUS	Modi's Navnirma	Bonus Ratio 3:1	15-11-2022	15-11-2022
BONUS	Motherson SWI	Bonus Ratio 2:5	17-11-2022	16-11-2022
SPLITS	Arfin India	Oldfv 10 New fv 1	~	14-11-2022
SPLITS	Pressure Sentiv	Oldfv 10 New fv 1	~	16-11-2022
RIGHTS	Compuage Info	Rights Ratio 8:25 FV2 premium 18	14-11-2022	14-11-2022
RIGHTS	Compuage Info	Rights Ratio 1:1 FV10 premium 0	15-11-2022	15-11-2022
DIVIDEND	Power Grid Corp	Interim 50	15-11-2022	14-11-2022
DIVIDEND	Gloster	Interim 500	16-11-2022	15-11-2022
DIVIDEND	Coal India	Interim 150	16-11-2022	15-11-2022
DIVIDEND	Amara Raja Batt	Interim 290	16-11-2022	15-11-2022
DIVIDEND	Page Industries	Interim 700	18-11-2022	17-11-2022
DIVIDEND	MRF	Interim 30	18-11-2022	17-11-2022

Nifty Spot in Last Week:-

ઉપરમાં ૧૮૩૬૨.૩૦ અને નીચામાં ૧૭૯૬૯.૪૦ નો ભાવ જોવા મળ્યો હતો.



NIFTY WEEKLY CHART



BANKNIFTY WEEKLY CHART

Nifty Spot in Upcoming Week:-

ઉપરમાં ૧૮૫૫૦ થી ૧૮૬૫૦ supply zone છે નીચામાં ૧૭૮૦૦ થી ૧૭૬૦૦ demand zone છે.

Bank Nifty in Upcoming week:-

ઉપરમાં ૪૨૮૦૦ થી ૪૩૦૦૦ supply zone છે નીચામાં ૪૧૩૦૦ થી ૪૧૦૦૦ demand zone છે.

Recommendation for next week

Serial No.	Stock Name Cash segment	Above / Below / Add HOLD	CMP as on 12.11.2022	Trail SL	Buy Stop loss	Sell Stop loss	Target
1	JUBLPHARMA(BUY)	HOLD 374	383		360		400-420
2	ABCAPITAL(BUY)	HOLD 125	122		115		150
3	JUBLINGERA(BUY)	AROUND 540	575		523		600-650

Commodity Market

COPPER:~ ઘટાડે ૬૭૧ ના s1 થી ખરીદી કરી શકાય ઉપરમાં ૭૩૦ સુધી નો ભાવ આવી શકે.



CRUDEOIL:- ઉછાળે ૭૭૭૭ ના s1 થી વેચાણ કરી શકાય નીચામાં ૭૧૦૦ નો ભાવ આવી શકે, ઘટાડે ૭૦૫૦ ના s1 થી ખરીદી કરી શકાય ઉપરમાં ૭૫૦૦ સુધી નો ભાવ આવી શકે.



SILVER: :- ઉછાળે ૬૪૧૦૦ ના s1 થી વેચાણ કરી શકાય નીચામાં ૫૬૯૦૦ નો ભાવ આવી શકે.



GOLD:- ઉછાળે ૫૩૭૦૦ ના s1 થી વેચાણ કરી શકાય નીચામાં ૫૧૮૦૦ નો ભાવ આવી શકે.

Currency Market (Cash Levels)

USDINR:- ઉછાળે ૮૨.૦૦ થી ૮૨.૨૦ ની રેન્જમાં ૮૨.૭૦ ના s1 થી વેચાણ કરી શકાય નીચામાં ૮૦.૧૫ સુધી નો ભાવ આવી શકે,ઘટાડે ૮૦.૧૫ ની રેન્જમાં ખરીદી કરી શકાય ૮૦.૦૦ નો s1 રાખવો ઉપરમાં ૮૨.૦૦ સુધી નો ભાવ આવી શકે.



GBPINR:- ઉછાળે ૯૬.૦૦ થી ૯૭.૦૦ ની રેન્જમાં ૯૮.૧૦ ના s1 થી વેચાણ કરી શકાય નીચામાં ૯૦.૦૦ સુધી નો ભાવ આવી શકે,ઘટાડે ૯૦.૦૦ ની રેન્જમાં ખરીદી કરી શકાય ૮૫.૯૦ નો s1 રાખવો ઉપરમાં ૯૭.૦૦ સુધી નો ભાવ આવી શકે.



EURINR:- ઉછાળે ૮૫.૦૦ થી ૮૬.૦૦ ની રેન્જમાં ૮૭.૨૦ ના s1 થી વેચાણ કરી શકાય નીચામાં ૭૯.૦૦ સુધી નો ભાવ આવી શકે,ઘટાડે ૮૦.૦૦ ની રેન્જમાં ખરીદી કરી શકાય ૭૯.૦૦ નો s1 રાખવો ઉપરમાં ૮૬.૦૦ સુધી નો ભાવ આવી શકે.



JPYINR :- ઉછાળે ૬૦.૦૦ થી ૬૧.૦૦ ની રેન્જમાં ૬૧.૭૦ ના s1 થી વેચાણ કરી શકાય નીચામાં ૫૪.૦૦ સુધી નો ભાવ આવી શકે,ઘટાડે ૫૬.૦૦ ની રેન્જમાં ખરીદી કરી શકાય ૫૫.૦૦ નો s1 રાખવો ઉપરમાં ૬૦.૦૦ થી ૬૧.૦૦ સુધી નો ભાવ આવી શકે.

Currency CASH LEVEL	DEMAND ZONE LEVEL		CLOSE	SUPPLY ZONE LEVEL	
	D2	D1		S1	S2
USDINR	80.15	80.50	80.80	81.50	82.00
GBPINR	93.00	94.00	94.97	96.00	97.00
EURINR	81.00	82.00	82.96	83.50	84.50
JPYINR	56.50	57.00	57.48	58.00	58.50

Currency Corner

Premium / Discount (USD/ INR) Based on Forward Rates	
Duration	Premium
One month Forward	0.20
Three month Forward	0.44
Six month	1.24
One year	2.93

RBI reference Rates	
Currency	Rates
USD	80.64
GBP	94.49
Euro	82.46
100 Yen	56.96

રોકાણકારો રાહુલ દ્રવિડના ક્રિકેટમાંથી પાઠ શીખી શકે છે ભાગ:1

એ સમજવું અગત્યનું છે કે રોકાણમાંથી પૈસા કમાવવા એ માત્ર બુદ્ધિનું કાર્ય નથી. વર્તણૂકના ઘણા પાસાઓ જેમ કે ફોકસ, શિસ્ત વગેરે રોકાણની સફળતા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ સંદર્ભમાં, શ્રી સૌરભ મુખર્જી બતાવે છે કે રાહુલ દ્રવિડના ક્રિકેટમાંથી શું શીખવાનું છે. આ લેખ ધ ઈકોનોમિક ટાઈમ્સ પરથી લેવામાં આવ્યો છે

(<https://economictimes.indiatimes.com/markets/stocks/news/lessons-investors-can-learn-from-rahul-dravids-cricket/articleshow/80381050.cms>)

અન્ય કોઈપણ ક્રિકેટર કરતાં રાહુલ દ્રવિડની કારકિર્દીમાં માનસિક સ્થિતિ અને મનોવૈજ્ઞાનિક પ્રશિક્ષણ તકનીકોની શક્તિ વિશે આપણા બાકીના લોકો માટે પુષ્કળ પાઠ છે.

કોઈપણ અર્થપૂર્ણ ગણતરી દ્વારા... તે 24 દૂર જીત સાથે (સચિન તેંડુલકર 20) સાથે ભારતનો સૌથી મહાન મેચ વિજેતા બેટ્સમેન હતો, જ્યાં તેની સરેરાશ લગભગ 70 હતી. જ્યારે દબાણ અને મેચને શોષવાની ક્ષમતા જેવી બાબતોને સમીકરણમાં દાખલ કરવામાં આવે છે. અસર, તે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી મહાન શ્રેણી-નિર્ધારિત બેટ્સમેન છે, તેના આઠ શ્રેણી-નિર્ધારિત પ્રદર્શનની ગણતરી અન્ય કોઈ કરતાં વધુ છે.

રાહુલ દ્રવિડમાં સુરેશ મેનન - ટાઈમલેસ સ્ટીલ: ભારતીય ક્રિકેટના ગો-ટુ મેન (2012) પર એકત્રિત લખાણો

રાહુલ દ્રવિડના પ્રદર્શનના આંકડા દર્શાવે છે કે તે ભારતનો અત્યાર સુધીનો સૌથી મહાન ટેસ્ટ બેટ્સમેન છે. અને તેમ છતાં, જો તમે દ્રવિડના યુગના રમતગમતના લેખકો અને અન્ય ક્રિકેટરોને પૂછો કે તે શા માટે સફળ થયો, તો સર્વસંમતિ એવો હતો કે "દ્રવિડ સફળ થાય છે કારણ કે તે તેને સરળ રાખે છે."

તેથી, જો તેને સરળ રાખીને સફળ થવું એટલું સરળ છે, તો વધુ ક્રિકેટરો શા માટે નથી કરતા?

‘સરળ’ કેમ સરળ નથી?

બેટિંગ અને રોકાણ સહિત - જીવનના કોઈપણ ક્ષેત્રોમાં મોટી સફળતાના મૂળમાં - 99.99% વસ્તીની પહોંચની બહાર હોય તેવા પરિણામો હાંસલ કરવા માટે તેમના મગજને તાલીમ આપવાની નાની સંખ્યામાં વ્યક્તિઓની ક્ષમતા રહેલી છે. જ્યારે આ વ્યક્તિઓ જે કરે છે તે સરળ હોઈ શકે છે, તેનો અર્થ એ નથી કે તે સરળ છે. વ્યાપક રીતે કહીએ તો, રાહુલ દ્રવિડની જેમ બેટિંગ કરવી આસાન કેમ નથી તેના પાંચ કારણો છે.

પ્રથમ, દ્રવિડની તાલીમ અને તેની મૂળભૂત માનસિક સ્થિતિની શરૂઆત તે લગભગ આઠ વર્ષનો હતો. ત્યારે જ તેના કોચ કેકી તારાપોરે તેને સીધા બેટ વડે રમવાનું મહત્વ અને ઉચ્ચ કૌશલ્ય હાંસલ કરવામાં અવિરત અભ્યાસની કેન્દ્રીય ભૂમિકા શીખવવાનું શરૂ કર્યું. માલ્કમ ઝેડવેલે આઉટલિયર્સ (2008) માં તેમના પ્રખ્યાત '10,000 કલાક પ્રેક્ટિસ' સિદ્ધાંત વિશે લખ્યું તેના ઘણા સમય પહેલાં, કેકી તારાપોર (દ્રવિડ માટે), રમાકાંત આચરેકર (સચિન તેંડુલકર માટે) અને દેશ આઝાદ (કપિલ દેવ માટે) જેવા હજારો ભારતીય કોચોએ તેમની તાલીમ લીધી

હતી. આ સિદ્ધાંતને અનુસરવા માટે વોર્ડ. ફઝલ ખલીલ તરીકે, તેની શાળાની ક્રિકેટ ટીમમાંથી દ્રવિડના સાથી, જેણે તેની સાથે રણજી ટ્રોફી ક્રિકેટ પણ રમી હતી, તે યાદ કરે છે:

“તેણે વિગતવાર ધ્યાન આપ્યું, ખાસ કરીને મૂળભૂત બાબતો. જો તેનું ફોર્મ સારું ન હતું, તો તે શેડો-પ્રેક્ટિસમાં પાછો જશે - હેંગિંગ બોલ પર. અમારી મૂળભૂત બાબતોમાં સુધારો કરતી વખતે, અમારા કોચ, કેકી તારાપોર, અમને કહેતા કે જો બેટ સીધું નીચે ન આવે, તો બોલ એક ખૂણા પર જશે.

“તેણે વિગતવાર ધ્યાન આપ્યું, ખાસ કરીને મૂળભૂત બાબતો. જો તેનું ફોર્મ સારું ન હતું, તો તે શેડો-પ્રેક્ટિસમાં પાછો જશે - હેંગિંગ બોલ પર. અમારી મૂળભૂત બાબતોમાં સુધારો કરતી વખતે, અમારા કોચ, કેકી તારાપોર, અમને કહેતા કે જો બેટ સીધું નીચે ન આવે, તો બોલ એક ખૂણા પર જશે.

રાહુલ ક્યારેય સૂચના ભૂલ્યો નહીં. રસપ્રદ વાત એ છે કે, તેણે ક્યારેય તેના મૂળભૂત ક્રિકેટમાં અથવા રમત પ્રત્યેના તેના અભિગમમાં કોઈ ફેરફાર કર્યો નથી. શાળાના દિવસોથી જ તે આ જ રીતે રમે છે. V માં રમવું તેની પાસે સ્વાભાવિક રીતે આવ્યું હતું અને તેણે ક્યારેય તેમાં ફેરફાર કર્યો નથી.

જ્યારે ભારતના મોટા મહાનગરોમાં ઉછરેલા ઘણા શાળાના છોકરાઓને આવી કોચિંગ અને બેટિંગ સુવિધાઓ મળી શકે છે, જ્યાં દ્રવિડ ખરેખર તેના સાથીદારોથી દૂર થઈ ગયો હતો તે તેની પ્રેક્ટિસની ભૂખ હતી. 2000-05 દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના કોચિંગ કરનાર જોન રાઈટ વિશ્વને પ્રથમ વ્યક્તિ હતા જેમણે નેટ પ્રેક્ટિસને કેટલી ગંભીરતાથી લીધી હતી:

મેં નેટમાં રાહુલ કરતાં વધુ સમર્પિત ક્રિકેટર ક્યારેય જોયો નથી. તે રમતની પરિસ્થિતિનું અનુકરણ કરવામાં સક્ષમ હતો, માત્ર ગતિમાંથી પસાર થઈને જ નહીં, પરંતુ દરેક બોલની ગણતરી કરીને. એવું હતું કે તે નેટમાં પણ બહાર નીકળવા માંગતો ન હતો. એવી સ્થિતિમાં

જ્યારે અમારી પાસે ત્રણ કે ચાર બોલર તેની તરફ જતા હતા, તે સ્પર્ધા કરવા માંગતો હતો. તે હંમેશા પોતાની જાતને કસોટી કરતો હતો..."

રાહુલ માત્ર નેટમાં જ પ્રેક્ટિસ કરતો નહોતો, માનસિક રીતે પણ તે દરેક જગ્યાએ અને દરેક સમયે શોટની પ્રેક્ટિસ કરતો હતો. તેમની પત્ની વિજેતાએ લગ્ન કર્યા પછી તરત જ આ હકીકત શોધી કાઢી હતી.

“જ્યારે હું [જાન્યુઆરી 2004માં] મેલબોર્ન અને સિડની ગયો હતો....હું હજુ પણ તેને જાણવાનો, તેની રમત જાણવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે પછી જ મેં ધ્યાન આપવાનું શરૂ કર્યું કે તે કેવી રીતે તૈયારી કરશે: તેની દિનચર્યાઓ, દિવસના તમામ કલાકોમાં છાયા પ્રેક્ટિસ પ્રત્યેનો તેમનો જુસ્સો, જે મને પહેલા ખૂબ જ વિચિત્ર લાગ્યું...” આ શક્તિઓ ઉપરાંત, રાહુલ દ્રવિડ પ્રથમ ટેસ્ટ ક્રિકેટરોમાંનો એક હતો જેણે તેની રમતને સુધારવા માટે સેટ દિનચર્યાઓ અને માનસિક કન્ડિશનિંગ તકનીકોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. દ્રવિડે આ દિનચર્યાઓની પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું, જ્યારે તે સ્ક્રૂલબોય ક્રિકેટર હતો. ફઝલ ખલીલ તરીકે, દ્રવિડના શાળાના સાથી અને રણજી ક્રિકેટ, સા

એક રૂમમેટ તરીકે રાહુલ અઘરો અને સહેલો હતો. તેને રૂમમાં ઝેન જેવું વાતાવરણ જોઈતું હતું - બધું જ શાંતિપૂર્ણ અને શાંત. તે શાંત અને ધ્યાનશીલ હતો, ટીવી વધુ જોતો ન હતો; તે તેના બદલે પુસ્તકો વાંચે છે... તે દિવસોમાં પણ તેની દિનચર્યાઓ અને ધાર્મિક વિધિઓ હતી. જલનેતીની પ્રાચીન પ્રથાનો ઉપયોગ કરીને તે શ્વાસ લેવાની કસરતો કરશે અને નાકને સાફ કરશે."

ડિસ્ક્લેમર: આ કોલમમાં વ્યક્ત કરાયેલા મંતવ્યો લેખકના છે. અહીં દર્શાવેલ તથ્યો અને મંતવ્યો અમારા વિચારને પ્રતિબિંબિત કરતા નથી

HEAD OFFICE

B/230-231, International Trade Center, Majura Gate, Ring Road, Surat-2.(Guj.) India Ph: 0261- 40 60 750, 246 27 90
Fax : 0261-246 27 91 www.markethubonline.com E-Mail : info@markethubonline.com

IA SEBI Registration no.:INA000005333

Disclaimer:

We do not represent that information provided by us is accurate or complete and it should not be relied upon as such. The advice provided here is just for knowledge purpose only. The user assumes the entire risk of any use made or not made of this information.

INVESTMENT IN EQUITY, MUTUAL FUND, EQUITY, CURRENCY & COMMODITY DERIVATIVES IS SUBJECT TO RISK. WE ARE DISTRIBUTOR OF MUTUAL FUND.

Client should read the Risk Disclosure Document (RDD) & Do's and Don'ts issued by SEBI & relevant exchanges before investing.